

મધમાખી પાલન અને વ્યવસ્થાપન અંગેનો તાલિમ વર્ગ યોજાયો

કીટકશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ દ્વારા “મધમાખી પાલન અને વ્યવસ્થાપન” અંગેની તાલિમ તા: ૦૩/૧૦/૨૦૧૮ થી ૦૬/૧૦/૨૦૧૮ દરમ્યાન ગોઠવવામાં આવેલ. જેમાં ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાના કુલ ૩૪ મધમાખી પાલનમાં રસ ધરાવતા ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલ.

આ તાલિમ કાર્યક્રમમાં મધમાખી પાલનને લગતા વિવિધ વિષય પર જુદા જુદા નિષ્ણાંતો દ્વારા લંબાણપૂર્વક ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવેલ. આ ઉપરાંત મધમાખી પાલનની શરૂઆત કરતી વખતે લેવાની થતી કાળજીઓ, ઋતુ મુજબ મધમાખી પાલન, કૃત્રિમ રાણી ઉછેરની પદ્ધતિ, મધમાખી પાલન માટે જરૂરી સાધનો, પરાગરજ અને મધુરસ પુરી પાડતી વનસ્પતિઓ, મધ કાઢવાની પદ્ધતિ તેમજ મધના પ્રોસેસીંગ વિશે પર પ્રાયોગિક તાલિમ આપવામાં આવેલ.

જંતુનાશકોના આડેઘડ છંટકાવથી પર્યાવરણમાં મધમાખીની વસ્તી ઘટતી જાય છે, જેની સીધી અસર પાક ઉત્પાદન પર જોવા મળે છે. આથી સંકલિત જીવાત વ્યવસ્થાપન અપનાવી, જંતુનાશકનાં છંટકાવ તેમજ પાક સંરક્ષણ ખર્ચ ઘટાડી, રસાયણમુક્ત અને ગુણવત્તાસભર ખેત ઉત્પાદનની સાથે સાથે મધમાખી પાલન તેમજ મધમાખીની જાળવણી અંગેની જાણકારી ખેડૂતોને મળે અને મધમાખી પાલન અંગેની જગૃતતા કેળવાય તે માટે આ તાલિમનું આયોજન કરવામાં આવેલ.

કાર્યક્રમ દરમ્યાન સર્વે ખેડૂત ભાઈઓ તથા બહેનોને સોલધરા ખાતે આવેલ સહ્યાદ્રી મધમાખી ઉછેર કેન્દ્ર કે જે મધમાખી માટે એક સફળ ગાથા રૂપ છે તેની પણ પ્રત્યક્ષ મુલાકાત તા. ૦૫-૧૦-૨૦૧૮ના રોજ લેવાડાવી ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ. કાર્યક્રમમાં તાલિમાર્થીઓએ પોતાના તાલિમ પ્રત્યેના પ્રતિભાવો પણ આપેલ હતા અને જણાવ્યું હતું કે આ તાલીમથી અમે મધમાખી પાલન કરવા માટે પ્રેરાયા છીએ.

આ તાલિમ કાર્યક્રમનાં અંતિમ દિવસે ડૉ. પી. કે. બોરડ, પ્રાધ્યાપક અને વડાએ તાલિમની જાણકારી બીજા ખેડૂતો સુધી પહોંચે તેવી અભ્યર્થના સાથે આશીર્વાચન આપેલ તથા કાર્યક્રમ દરમ્યાન તેઓના હસ્તે પ્રમાણપત્રનું વિતરણ પણ કરવામાં આવેલ. કાર્યક્રમમાં કીટકશાસ્ત્ર વિભાગમાંથી ડૉ. ડી. બી. સીસોદીયા, સહ સંશોધન વૈજ્ઞાનિક; ડૉ. આર. કે. કુમર, સહ પ્રાધ્યાપક; પ્રો. મિરલ સુથાર, મદદનીશ પ્રાધ્યાપક; ડૉ. સી. બી. ધોબી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તથા મિનાક્ષી લુણાગરીયા, ખેતી અધિકારી હાજર રહ્યા હતા.

